

JKP/SH/2024

24th February 2024

Electronic Filing

Department of Corporate Services/Listing
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai – 400 001

Scrip Code No. 532162

National Stock Exchange of India Ltd.
“Exchange Plaza” Bandra-Kurla
Complex, Bandra (E),
Mumbai – 400 051

Symbol : JKPAPER
Series : EQ

Dear Sir/ Madam,


Re: Newspaper Advertisements of Completion of despatch of the Postal Ballot Notice

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of advertisements published on 24th February 2024, in “Financial Express” (all editions) including Financial Express (Ahmedabad Edition, Gujarati translated) newspapers, relating to completion of despatch of Postal Ballot Notice dt.12th February 2024, to the Members of the Company.

Submitted for your kind information and necessary records.

Thanking you,

Yours faithfully,
For JK Paper Limited

 (Deepak Gupta)
Company Secretary

Encl: a/a



IN CONVERSATION WITH SANDEL

Political philosopher and Harvard University Professor Michael J Sandel in conversation with Anant Goenka, Executive Director, The Indian Express Group, and Aakash Joshi, Deputy Associate Editor, The Indian Express, at the Express Adda in New Delhi on Friday

RENUKA PURI

IIM placements stable, fewer consulting jobs

Pay packages see an uptick from 2023

MANU KAUSHIK
New Delhi, February 23

EVEN AS SOCIAL media is abuzz with stories of bleak placements in the top-tier business schools, at least some Indian Institutes of Management (IIMs) have reported placement figures above last year's levels.

However, the early trend of recruitment from these top-notch business schools this year indicates a drop in job offers from consultancy firms, who generally pay better salaries.

An IIM-Calcutta spokesperson told FE that as many as 194 companies have come to recruit students from its PGP (post-graduate programme) batch this year, compared with 190 last year. The premium B School's highest pay package too saw an uptick from ₹1.05 crore last year to ₹1.15 crore in 2024.

At IIM-Lucknow, the number of recruiters have jumped from around 200 last year to over 250 this year, but this may also be due to a drop in placement offers from top-notch companies, allowing others to fit the bill. The total job offers at the institute remained nearly static this year at 634, compared with 632 last year.



Though IIM Ahmedabad refused to divulge the placement details for the current year, it said that the campus witnessed 23 new recruiters this year, including Bluestone, Crompton Greaves, DE Shaw, Diageo, HDFC ERGO, India Sotheby's International Realty, and others.

Despite the grim job scenario, how the IIMs (Ahmedabad, Calcutta and Lucknow) have managed to do well. A professor at IIM Kozhikode, who didn't wish to be identified, said that "though the profile of the recruiters changes in a bad year, the salaries aren't impacted. We (IIMs) have built credibility over the years. Of course, the job offers tend to be different in a tough market."

For instance, he said, if job offers from the consultancy firms are fewer, students would opt for brick-and-mortar companies who will still offer com-

parable salaries.

This is evident in the placement records of this year. Of IIM Calcutta's 2024 placements, the consulting sector had the largest share of 32% followed by firms seeking people for general management roles (24.6%).

In the latter category, companies such as ITC, Dabur, Vedanta, Adani, Hinduja, Aditya Birla Group, JSW, Reliance remained top recruiters. Last year, the number of consulting job offers was higher at 40.5%, and the general management roles were just 14.3% of the total offers.

"The best companies are always in need of talented people. If the top-notch institutes like IIMs are witnessing some change in their placement patterns, it could be due to general market conditions and specific to the capabilities of individual students in these institutes," said Ronesh Puri, MD at Executive Access.

Akash Deep's long journey to dream debut: 'Like bumpy road in my village'

SANDIP G
Ranchi, February 23

IN THE MOST glorious hour of his career, pacer Akash Deep decided to roll back the years.

The day that had started with him claiming three England wickets in his first six overs in Tests would end with him talking about the days when his cricket career was going nowhere.

Akash would recall 2015, when his father suffered paralysis and died due to medical negligence. It was the year he lost his elder brother as well.


His voice choking, Akash said: "My father wanted me to do something in life but I couldn't do anything while he was alive." Then resisting a tear, he dedicated his 3/70 effort on Day 1 to his father.

England, at stumps, were 302/7.

For Akash, it was an eventful morning. An hour before start, coach Rahul Dravid presented him with the Test cap. A bright smile spread over his face, before the 27-year-old went over to the boundary ropes where his mother and relatives were waiting. He hugged them and strolled back to the pavilion at the other end of the stadium.

The family were understandably emotional, they had been through a lot. "Apne gaon ki sadak jaisi journey rahi hai bilkul, ubad khabad (My journey has been like the road in my village, bumpy)," he had once told *The Indian Express*, recollecting his days in Dehri village in Bihar's Sasaram.

His father was a school teacher who wanted his son to pursue academics. Akash, though, loved cricket. But there were no facilities in his village. When asked how he started playing cricket in



Akash Deep was 18 when he picked up a red ball for the first time in his life

The breakthrough moment of his career came in 2019, when Bengal picked him to play Ranji Trophy

Resisting a tear, he dedicated his **3/70** effort on Day 1 to his father

England, at stumps, were **302/7**

childhood, he would sarcastically say: "Mera bachpan mein cricket tha hi nahin! (There was no cricket in my childhood)." Cricket, though, would turn into his obsession in his teenage years. However, it was not until he turned 18 that he picked up a red ball for the

first time in his life.

Nine years later, though, he is in his dreamland.

"Like any kid who plays cricket, it was my dream also to play Test cricket for India. But I never thought that I would realise it one day," he says.

The breakthrough moment

of his career came in 2019, when Bengal picked him to play Ranji Trophy. An avenue opened, and he grabbed it with both hands. His journey would gather speed. Two years later, IPL franchise Royal Challengers Bangalore signed him. There he would pick the brains

of Australia seamer Josh Hazlewood and gain valuable inputs from Virat Kohli.

He left an impression wherever he went. "Life has been such that I know I need to make every opportunity of mine count," he says. Little doubt that he seized the first hour of his Test debut, bowling with maturity of a veteran, blending pace and aggression, knowing exactly what lengths to bowl.

Days before his Test debut, he had sought the advice of Jasprit Bumrah, who was rested from this game. He imparted a valuable piece of advice. "Bumrah bhai told me to hit back of length on this pitch. He said at international level, batsmen keep trying to get forward at you, so back of length is better," Akash told broadcasters. And so he did, all three of his wickets came off hard length balls.

But his run-up, action and the skiddy pace was more reminiscent of Mohammed Shami, his Bengal colleague and his inspiration. He smiled shyly when the resemblance was put across. Emotion, though, didn't overwhelm him.

"It was very emotional but I also felt that there was a responsibility on my shoulders to do something for the team," he says.

For someone playing his first Test, he was staggeringly composed. The first time he hit the stumps — a nip-backer beat Zak Crawley — it turned out to be no-ball. But he wasn't shattered. "As an individual, I didn't feel very bad because I knew that if I don't get him out, then someone else in my team will," he says.

He would soon attain, nabbing the wickets of dangerous opener Ben Duckett and in-form No. 3 Ollie Pope in the space of three balls. Then at the stroke of drinks break in the first session, he dislodged Crawley with another deadly in-ducker. His day was made.

Technopark invites RFP for new building

TECHNOPARK AT THIRUVANANTHAPURAM has invited request for proposal (RFP) for an 800,000-sq ft IT building at Phase IV (Technocity) in Kerala's premier information technology hub.

The building, which can accommodate 6,000 professionals, is part of its presti-

gious Quad project — an integrated mini township with work, live, and leisure spaces — coming up on 30 acres.

The technical and financial bid to build and operate is to be submitted before 4 pm on March 12, 2024, as per the terms and conditions specified in this RFP.

The successful bidder should complete the building in 30 months from the date of LoA. An extension of another period of maximum 6 months can be permitted, on any valid reasons of delay that are not directly attributed to the bidder/co-developer or developer. **FE BUREAU**

JK PAPER LIMITED
CIN: L21010GJ1960PLC018099, Website: www.jkpaper.com
Regd. Office: P.O. Central Pulp Mills — 394 660, Fort Songadh, Distt. Tapi, Gujarat
Admin. Office: Nehru House, 4, Bahadur Shah Zafar Marg, New Delhi-110 002
Phone: +91 11 6600 1132, 2331 1112-5, E-mail: s.sharesjkpaper@jkmall.com

NOTICE OF POSTAL BALLOT

- Notice is hereby given that pursuant to the provisions of Sections 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022, 11/2022 dated December 28, 2022, 09/2023 dated September 25, 2023 issued by the Ministry of Corporate Affairs (MCA Circulars), the Company has completed the despatch of Notice of Postal Ballot dated 12th February 2024 along with Statement ("the Notice") through electronic means on Friday, 23rd February 2024 for seeking approval of the Members of the Company in respect of business mentioned in the Notice, by voting through electronic means (remote e-voting) only. The Company has engaged Central Depository Services (India) Limited for providing remote e-voting facilities to its Members. The detailed instructions for remote e-voting are given in the Notice.
- In accordance with aforesaid MCA circulars, the Notice has been sent only through electronic mode to those Members, whose names appeared in the Register of Members/List of Beneficial Owners as received from National Securities Depository Limited ("NSDL") and Central Depository Services (India) Limited ("CDSL") as on Friday, 16th February 2024 (cut-off date) and who have registered their e-mail addresses with the MCS Share Transfer Agent Ltd., Registrar and Share Transfer Agent (RTA) of the Company or the Depository Participant(s). In terms of the aforesaid MCA Circulars, the requirement of sending the physical Notice of Postal Ballot along with the Postal Ballot Form in physical form has been dispensed with till 30th September 2024. Accordingly, physical copies of Notice of Postal Ballot and Postal Ballot Form have not been sent to any Member of the Company. A person who is not a Member as on a cut-off date should treat the Notice for information purpose only.
- The Notice is available on the website of the Company at www.jkpaper.com, on the websites of the Stock Exchanges where the shares of the Company are listed i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively and also available on the website of CDSL at www.evotingindia.com.
- The remote e-voting period will commence on Sunday, 25th February 2024 from 10:00 AM and ends on Monday, 25th March 2024 at 5:00 PM. The remote e-voting module shall not be allowed beyond the said date and time. The voting rights shall be reckoned on the paid-up value of shares registered in the name(s) of the Member(s) as on the cut-off date. The Company has appointed Shri Namo Narain Agarwal, Company Secretary in Practice, as the Scrutinizer and failing him, Shri Naveen Kumar Rastogi, Company Secretary in Practice, as the Alternate Scrutinizer, for conducting the Postal Ballot through remote e-voting process in a fair and transparent manner.
- The Results of the remote e-voting will be declared within two (2) working days from the conclusion of remote e-voting i.e. on or before Wednesday, 27th March 2024. The results declared along with the Scrutinizer's Report shall be placed on the website of the Company at www.jkpaper.com and on the website of CDSL at www.evotingindia.com and shall simultaneously be forwarded to the BSE Ltd. and National Stock Exchange of India Ltd.
- Manner of registering/updating email addresses:**
 - For Physical members - Please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhar (self-attested scanned copy of Aadhar Card) by email to the Company at sharesjkpaper@jkmall.com /RTA at admin@mcsregistrars.com.
 - For Demat members - Please update your email id with your respective Depository Participant (DP) After due verification, the Company will forward the procedure for obtaining their login credentials to their registered email addresses.
- All grievances connected with the facility for voting by electronic means may be addressed to Shri Rakesh Dalvi, Sr. Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurax, Mafatal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdsindia.com or call at toll free no. 1800 22 55 33.

For JK PAPER LIMITED
Sd/-
(Deepak Gupta)
Company Secretary

Date: 23rd February 2024
Place: New Delhi

Tejas Networks Limited
CIN: L72900KA2000PLC026980
Regd. Office: J P Software Park, Plot No. 25, Sy. No. 13, 14, 17, 18, Konnapana Agrahara Village, Begur Hobli, Bengaluru-560100, Karnataka Phone: +91-80-4179 4600 | Fax: +91-80-2852 0201
Website: www.tejasnetworks.com | Email: corporate@tejasnetworks.com

NOTICE OF THE POSTAL BALLOT

Members of Tejas Networks Limited (the "Company") are hereby informed that pursuant to the provisions of Sections 108 and 110 of the Companies Act, 2013, read with Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, as amended (Rules), read with the General Circular Nos. 14/2020 dated 8th April, 2020, 17/2020 dated 13th April, 2020, and the latest one being General Circular No. 9/2023 dated 25th September, 2023 issued by the Ministry of Corporate Affairs (MCA Circulars) and any other applicable law, rules and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force and as amended from time to time), Tejas Networks Limited (the Company) is seeking consent of its Members on the following matter through postal ballot ("the Postal Ballot") only by way of remote e-voting ("e-voting") for the following resolution:

Type of Resolution	Special Resolution
Particulars	Re-appointment of Arnob Roy (DIN: 03176672) as Whole-time Director and designated as Executive Director and Chief Operating Officer and payment of remuneration thereof.

The Postal Ballot Notice is also available on the website of the Company www.tejasnetworks.com, website of BSE Limited ("BSE"): www.bseindia.com and National Stock Exchange of India Limited ("NSE"): www.nseindia.com on which the Equity Shares of the Company are listed and on the website of National Securities Depository Limited (NSDL): www.evoting.nsdil.com.

Members of the Company whose names appear in the Register of Members/ List of Beneficial Owners as received from Depositories (i.e.) NSDL/CDSL as on Friday, February 16, 2024 shall be entitled to vote in relation to the resolution specified in the postal ballot Notice. The Company has appointed NSDL for facilitating remote-voting to enable the Members to cast their votes electronically. Members including those who are holding shares in physical form or who have not registered their e-mail addresses, can cast their votes by following the instructions mentioned in the Postal Ballot Notice dated February 21, 2024.

The remote e-voting period commences on Saturday, February 24, 2024 at 9:00 A.M. (IST) and ends on Sunday, March 24, 2024 at 5:00 P.M. (IST). The remote e-voting shall not be allowed beyond the said date and time and shall be disabled for voting thereafter. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently. The voting rights of the Members shall be in proportion to their shares in the total paid-up equity share capital of the Company as on Friday, February 16, 2024.

In case of any queries or issues or grievances pertaining to e-voting, Members may refer to Help/FAQ's section, available at www.evoting.nsdil.com or call on the toll free no.: 1800-1020-990/1800-224-430 or send a request at evoting@nsdl.co.in or contact Ms. Pallavi Mhatre, Manager, National Securities Depository Limited at pallavid@nsdl.co.in or at telephone no.: +91-22-2499 4545. Alternatively, Members may also write to the Company Secretary of the Company at corporate@tejasnetworks.com or contact at telephone no.: +91-80-41876400.

The results of the Postal Ballot shall be declared within 2 (two) working days from the conclusion of the e-voting period and along with the Scrutinizer's report, be displayed at the Registered Office of the Company, communicated to the Stock Exchanges and will also be uploaded on the Company website at www.tejasnetworks.com

For and on behalf of the Board of Directors
S/-
N R Ravikrishnan
General Counsel, Chief Compliance Officer
and Company Secretary
ACS No.: A 7875

Place: Bengaluru
Date: February 23, 2024

Silgo Retail Limited

Our Company was incorporated as "Silgo Retail Private Limited" on January 9, 2016, under the Companies Act, 2013 with the Registrar of Companies, Jaipur. Subsequently, our Company was converted into a Public Limited Company and the name of our Company was changed to "Silgo Retail Limited" vide special resolution dated July 24, 2018 and a fresh certificate of incorporation consequent to the conversion was granted to our Company on July 28, 2018, by the Registrar of Companies, Jaipur. The registered office of our Company was originally situated at 29, Chyava Nagar, Tonk Road, Sangarner, Jaipur, India. Thereafter, the registered office of our Company was changed to B-11, Mahaxmi Nagar, Jawahar Lal Nehru Marg, Jaipur - 302 017, Rajasthan. For details in relation to the changes in the registered office of our Company, please refer to "General Information" on page 36 of the Letter of Offer dated February 16, 2024.

Registered Office: B-11, Mahaxmi Nagar, Jawahar Lal Nehru Marg, Jaipur - 302 017, Rajasthan, India, Tel: +91 0141-4919655, Website: www.silgo.in
Contact Person: Tripti Sharma, Company Secretary & Compliance Officer, Email: info@silgo.in,
Corporate Identity Number: L36911RJ2016PLC049036

CORRIGENDUM TO THE LETTER OF OFFER DATED FEBRUARY 16, 2024
(THE "LETTER OF OFFER" / "LOF") AND THE ABRIDGED LETTER OF OFFER (THE "ALOF"):
NOTICE TO INVESTORS (THE "CORRIGENDUM")

PROMOTER OF OUR COMPANY: NITIN JAIN AND BELA AGRAWAL

ISSUE OF UP TO 1,62,70,000 FULLY PAID UP EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH OF OUR COMPANY (THE "RIGHTS EQUITY SHARES") FOR CASH AT A PRICE OF ₹25/- PER EQUITY SHARE (INCLUDING A PREMIUM OF ₹15/- PER EQUITY SHARE) (THE "ISSUE PRICE"), AGGREGATING UP TO ₹2,56,75,00,000 ON A RIGHTS BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 1 EQUITY SHARE FOR EVERY 1 FULLY PAID-UP EQUITY SHARES HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS THURSDAY, FEBRUARY 22, 2024 (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS 2.5 TIMES THE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, PLEASE REFER TO "TERMS OF THE ISSUE" BEGINNING ON PAGE 140 OF LETTER OF OFFER.

Assuming full subscription.

This is with reference to the Letter of Offer ("LOF") dated February 16, 2024 filed by the Company with the NSE (the "Stock Exchange") and the Securities and Exchange Board of India ("SEBI") (for information purpose only). Applicants / Investors may note the following modifications to the disclosures in the Letter of Offer, the Abridged Letter of Offer, Application Form, Rights Entitlement Letter dated February 16, 2024 and the same may be taken as updated and included in the Letter of Offer, the Abridged Letter of Offer, Application Form, Rights Entitlement Letter:

At the time of filing the Letter of Offer, the Issue Closing Date was scheduled to be Tuesday, March 12, 2024. However, as per the powers stated in the Letter of Offer to the Board of directors to extend the said date of closing of rights issue offer period as may be determined by them from time to time, the Board of Directors, in their meeting held on Friday, February 23, 2024 have decided to extend the issue period by three (3) day for the benefit of investors and consequently, the issue closing date shall be revised as "Friday, March 15, 2024". Last date of an market renunciation of Rights Entitlement shall be revised to "Monday, March 11, 2024", i.e. four days prior to the Issue closing date, last date for physical shareholders to furnished the details of their demat account to the Registrar or our Company shall be revised to "Wednesday, March 13, 2024" i.e. at least two Working Days prior to the Issue Closing Date and Last date for credit of REs in the demat account of Physical shareholders who have provided their demat account shall be revised to "Thursday, March 14, 2024" i.e. at least one Working Days prior to the Issue Closing Date.

The Letter of Offer and the Abridged Letter of Offer, including Application Form and Rights Entitlement Letter to be modified in terms of Issue Closing Date and the same is modified to be read as "Friday, March 15, 2024".

The disclosure of Issue Closing Date in Letter of Offer will be modified as above and would be read as follows in all of the pages stated below:

- On the front page i.e. Cover Page under the head "ISSUE PROGRAMME" — Issue Closes on **Friday, March 15, 2024**.
- On page No. 4 in Section I - DEFINITIONS AND ABBREVIATIONS under the Issue Related Terms the definition of "Issue Closing Date" shall be revised as **"Friday, March 15, 2024"**.
- On page No. 4 in Section I - DEFINITIONS AND ABBREVIATIONS under the Issue Related Terms the definition of "On Market Renunciation" shall be revised as "... on or before **Monday, March 11, 2024**".
- On page No. 4 in Section I - DEFINITIONS AND ABBREVIATIONS under the Issue Related Terms the definition of "Renunciation Period" shall be revised as **"Monday, March 11, 2024"**.
- On page no. 39 and 162 in Section III - INTRODUCTION under the head "General Information" in "Issue Schedule", shall be revised as

Last Date for credit of Rights Entitlements (on or about)	Tuesday, February 27, 2024
Issue Opening Date	Wednesday, February 28, 2024
Last date for On Market Renunciation of Rights Entitlements	Monday, March 11, 2024
Issue Closing Date	Friday, March 15, 2024
Finalization of Basis of Allotment (on or about)	Friday, March 22, 2024
Date of Allotment (on or about)	Saturday, March 23, 2024
Date of credit (on or about)	Saturday, March 23, 2024
Date of listing (on or about)	Thursday, March 28, 2024

#Eligible Equity Shareholders are requested to ensure that renunciation through off-market transfer is completed in such a manner that the Rights Entitlements are credited to the demat account of the Renouncers on or prior to the Issue Closing Date.

"Our Board, or a duly authorized committee thereof, will have the right to extend the Issue Period as it may determine from time to time not exceeding 30 days from the Issue Opening Date (inclusive of the Issue Opening Date). Further, no withdrawal of Application shall be permitted by any Applicant after the Issue Closing Date.

- On page no. 39 and 162 in Section III - INTRODUCTION under the head "General Information" in "Issue Schedule", paragraph "... no later than two Working Days prior to the Issue Closing Date" shall be revised as "Wednesday, March 13, 2024" and "... one day prior to the Issue Closing Date" shall be revised as "Thursday, March 14, 2024"
- On page no. 150 in Section VII - ISSUE INFORMATION under the head "Terms of the Issue" in "Options available to the Eligible Equity Shareholders", paragraph "... no later than two Working Days prior to the Issue Closing Date" shall be revised as "Wednesday, March 13, 2024"
- On page no. 152 in Section VII - ISSUE INFORMATION under the head "Terms of the Issue" in "On market renunciation", paragraph "... On Market Renunciation" shall be revised as "Monday, February 26, 2024 to Friday, March 15, 2024 (both days inclusive)"
- On page no. 155 in Section VII - ISSUE INFORMATION under the head "Terms of the Issue" in "PROCESS OF MAKING AN APPLICATION IN THE ISSUE" under "Last date for Application", the last date for submission of the duly filled in the Application Form is "Friday, March 15, 2024"

FOR SILGO RETAIL LIMITED
Sd/-
Ms. Tripti Sharma
Company Secretary and Compliance Officer
Date: February 23, 2024

Ahmedabad

